

ફેબ્રુઆરી 13, 2018

બ્રામ્પટન ટ્રાન્ઝિટ વર્ષ 2017 માં અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ

બ્રામ્પટન, ઓન્ટેરિયો - બ્રામ્પટન ટ્રાન્ઝિટને 2017 માં રાઈડરશિપમાં (સવારીઓની સંખ્યામાં) અભૂતપૂર્વ 18 ટકાના વધારા સાથે કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા ટ્રાન્ઝિટ (પરિવહન) પૂરું પાડનારાઓ પૈકી એક તરીકે ઓળખ મળી છે.

આ રાઈડરશિપ વૃદ્ધિનો આશરે અડધોઅડધ આંકડો શહેરના ઝુમ કોરિડોર્સ; ક્વીન સ્ટ્રીટ, મેઈન સ્ટ્રીટ, સ્ટીલ્સ એવન્યૂ અને બોવેઈર્ડ ડ્રાઈવની સાથે સાથે, સ્થાનિક અને ઝુમ રૂટ્સ એમ બંને પર જોવામાં આવ્યો.

ગ્રાહક અને કર્મચારીગણના પ્રતિભાવને લક્ષમાં લઈને, બ્રામ્પટન ટ્રાન્ઝિટ સેવા સુધારવા સતતપણે કાર્યરત છે. 2017 માં, પોતાના રાઈડર્સની માગણીઓને પહોંચી વળવા; નવા આવાસીય અને આર્થિક વિકાસોને સહાયરૂપ થવા લગભગ 36,000 ક્લાકો જેટલી સેવા આપવામાં આવી હતી. વધુમાં, ઝુમ સર્વિસીસ બ્રામ્પટનની બહાર પ્રવાસ ખેડે છે અને/અથવા ગો ટ્રાન્ઝિટ (GO Transit) અને અન્ય જીટીએચએ ટ્રાન્ઝિટ (GTHA transit) એજન્સીઓ, જેમ કે ટીટીસી, યોર્ક રિજીયન/વિવા (VIVA) અને મીવે (MiWay) સાથે સંકળાઈને કાર્યરત છે. આ જોડાણો રાઈડર્સને પડોશની મ્યુનિસિપાલિટીસમાં એકીકૃતપણે પ્રવાસ કરવા બહુવિધ વિકલ્પો પૂરા પાડીને, પ્રાદેશિક જોડાણોની સુલભતા વધારે છે.

બ્રામ્પટનની જુવાન, વૈવિધ્યસભર વસ્તી અને વસ્તીમાં એકંદરે વૃદ્ધિ પણ ઊંચી રાઈડરશિપ રાખવાનું પ્રેરકબળ બને છે. દરરોજ લગભગ 40 નવા લોકો બ્રામ્પટનમાં આવે છે, અને સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલી 2016 વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, 593,000 ની વસ્તીમાંથી, અડધી ઉપરાંત વસ્તી 24 વર્ષ નીચેની ઉંમરની છે, અને 52 ટકા લોકો કેનેડા બહાર જન્મેલા હતા.

અવતરણો (ક્વોટ્સ):

“કેનેડામાં સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરો પૈકી એક શહેર તરીકે, હું માનું છું કે બ્રામ્પટન રહેવાસીઓ સારી રીતે સંકળાયેલા નેટવર્ક અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે ચડિયાતી ટ્રાન્ઝિટ સેવાઓ મેળવવાને લાયક છે. આપણે સાર્વજનિક પરિવહનમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. સપ્ટેમ્બરમાં શરૂ થયેલો એરપોર્ટ રોડ ઝુમ સર્વિસનો ઉમેરો તાજેતરનું એક ઉદાહરણ છે. અમે આપણાં શહેરની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા રોકાણ કરવાનું અને સખત મહેનત કરતા રહેવાનું ચાલુ રાખીશું.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“આપણાં ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવું એ અમારા માટે ટોચની અગ્રતા છે અને અમે ઉત્કૃષ્ટ પરિવહન સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ વર્ષે, આપણી સેવાઓ સુધારવા અમે 65,000 સેવા ક્લાકો ઉમેરીશું અને આપણાં વેગીલા વિકાસને સહાયરૂપ બનવા અમે ખંતપૂર્વક કામ કરીશું. અમને બ્રામ્પટનિયનોના રોજંદા જીવનનો ભાગ બનવાનું ગૌરવ છે.”

- એલેક્સ મિલોયોજ (Alex Milojevic), જનરલ મેનેજર, બ્રામ્પટન ટ્રાન્ઝિટ

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca